



### બ્રેમ્પટનમાં COVID-19 નાં ફેલાવાને રોકવા સામાજિક હળવા-મળવાની સીમાઓ ઘટાડવામાં આવી

સીટીએ રહેવાસીઓના આરોગ્ય અને સુરક્ષાનું સંરક્ષણ કરવા COVID-19 બાય-લો (પેટા-કાનૂનો) જાન્યુઆરી 2021 સુધી લંબાવ્યા

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (સપ્ટેમ્બર 18, 2020) – ગઈકાલે, ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોએ જાહેરાત કરી કે આજથી અસરકારક અને તે રીતે, બ્રેમ્પટનમાં અને સમગ્ર પીલ રીજીયનમાં COVID-19 નાં ફેલાવાને રોકવા ટેમ્પરેખ ન રખાતા સામાજિક હળવા-મળવાના અને આયોજિત જાહેર પ્રસંગો ઘટાડીને ઈનડોર દસ વ્યક્તિઓ સુધી અને આઉટડોર 25 વ્યક્તિઓ સુધી કરવામાં આવ્યા છે. આવા આયોજનોમાં ખાનગી રહેઠાણો, બેકયાર્સ, પાર્કર્સ કે અન્ય મનોરંજનલક્ષી વિસ્તારોમાં પ્રસંગો, પાર્ટીઓ, ડિનર્સ, હળવું-મળવું, BBQs (બારબેક્યુસ) કે લગ્ન સમારંભોના આયોજનોનો સમાવેશ થાય છે.

નવી સીમાઓ કર્મચારીઓ ધરાવતા ધંધાઓ અને સગવડો, જેમ કે બાર્સ, રેસ્ટોરન્ટ્સ, સિનેમા, કન્વેન્શન સેન્ટર્સ કે બેન્કવેટ હોલ્સ, જીમ્સ, અને મનોરંજનલક્ષી રમતો કે પરફોર્મિંગ આર્ટ આયોજનોમાં યોજતા પ્રસંગો કે આયોજનોને લાગુ થશે નહીં. આ ધંધાઓ અને સગવડો માટે પહેલેથી હયાત નિયમો, જાહેર આરોગ્ય અને કાર્યસ્થળે સુરક્ષા ઉપાયો સહિતનો અમલ ચાલુ રહે છે. વધુ માહિતી માટે, ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોની [મીડિયા રીલીઝ](#) જુઓ.

રહેવાસીઓનું આરોગ્ય અને સુરક્ષાનું સંરક્ષણ કરવા અને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયો અને રીજીયન ઓફ પીલના COVID-19 નાં ફેલાવાને રોકવામાં મદદ મેળવવા, બ્રેમ્પટન સીટી કાઉન્સિલે બ્રેમ્પટન COVID-19 ઈમરજન્સી મેઝર્સ બાય-લો અને બ્રેમ્પટન COVID-19 મેન્ડેટરી ફેસ ક્વરિંગ્સ બાય-લોની સમાપ્તિ પણ જાન્યુઆરી 31, 2021 સુધી લંબાવી છે.

### બ્રેમ્પટન COVID-19 ઈમરજન્સી મેઝર્સ બાય-લો

બ્રેમ્પટન COVID-19 ઈમરજન્સી મેઝર્સ બાય-લો હેઠળ, વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર નિયમનું પાલન ન કરતી વ્યક્તિઓને દરેક ગુના માટે લઘુત્તમ \$500 અને મહત્તમ \$100,000 સુધીનો દંડ કરી શકાય છે.

પેટા-કાનૂન હેઠળ મ્યુનિસિપલ નિયમનો વર્ણવે છે કે:

- દરેક વ્યક્તિ દરેક બીજી વ્યક્તિથી ઓછામાં ઓછું 2.0 મીટરનું અંતર જાળવશે જ્યારે જાહેર મિલકતમાં હો, સિવાય કે આ વ્યક્તિઓ તે જ ઈમારતોમાં સાથે રહેતી હોય
- કોઈ પણ ધંધો પોતાના ધંધાની જગ્યામાં કે જગ્યાની બહાર કોઈ વ્યક્તિને બીજી દરેક વ્યક્તિથી 2.0 મીટરથી ઓછાં અંતરમાં બેસવા દેશે નહિ કે ઊભા રહેવા દેશે નહિ, સિવાય કે આ વ્યક્તિઓ તે જ ઈમારતોમાં સાથે રહેતી હોય અથવા તે વ્યક્તિઓ તે ધંધાના કર્મચારીઓ હોય.

### મેન્ડેટરી ફેસ ક્વરિંગ્સ બાય-લો



મેન્ટેટરી ફેસ કવરિંગ્સ બાય-લો હેઠળ, બ્રેમ્પટનમાં COVID-19 નો ફેલાવો રોકવામાં મદદ મેળવવા બધી ઈનડોર જાહેર જગ્યાઓમાં નોન-મેડિકલ મારક્સ કે ફેસ કવરિંગ્સ પહેરવા અનિવાર્ય બન્યા છે. આ હંગામી બાય-લો (પેટા-કાનૂન)માં જાહેર સંસ્થાઓ અને ધંધાઓએ પોતાના નિયંત્રણ હેઠળ ઈનડોર જાહેર જનતા માટેની જગ્યાઓમાં મારક્સ કે ફેસ કવરિંગ્સ પહેરવામાં આવતા હોવાની ખાતરી કરવી અનિવાર્ય બનશે.

આ બાય-લો (પેટા-કાનૂન) મુક્તિ આપે છે, તબીબી કારણોસર માર્ક કે ફેસ કવરિંગ ના પહેરી શકતી વ્યક્તિઓ સહિતની ચોક્કસ વ્યક્તિઓને; બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને; કટોકટી હુકમો અનુસાર એથલેટિક (કસરતી) પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તમય લોકોને અને એક પરવાનગી ધરાવતા એકમમાં ખોરાક કે પીણું લેતા લોકોને (જ્યારે પ્રોવિન્સ ઈનડોર ડાઈનિંગ ફરીથી ખોલવાની છૂટ આપે). સંપૂર્ણ યાદી માટે વેબસાઈટ

જુઓ: [brampton.ca/masks](http://brampton.ca/masks)

રહેવાસીઓ અને ધંધાઓ બિન-અનુપાલન નોંધાવવા 311 નંબર પર કૉલ કરી શકે છે.

COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં સીટી ઓફ બ્રેમ્પટનની અદ્યતન માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, [brampton.ca/COVID19](http://brampton.ca/COVID19)

### અવતરણો (ક્વોટ્સ):

“સીટી ઓફ બ્રેમ્પટન આપણાં સમુદાયનું સંરક્ષણ કરવા જરૂરી કોઈપણ પગલાઓ ભરવાનું ચાલુ રાખશે. હું રહેવાસીઓને મહેરબાની કરીને વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાનું આચરણ કરતા રહેવા, નવી સામાજિક હળવા-મળવાની સીમાને વળગી રહેવા અને બ્રેમ્પટન COVID-19 ઈમરજન્સી મેજર્સ બાય-લો અને મેન્ટેટરી ફેસ કવરિંગ્સ બાય-લો અનુસરવાની વિનંતી કરું છું. આપણે સૌએ બ્રેમ્પટનને સુરક્ષિત રાખવા અને આપણાં સમુદાયમાં COVID-19 નાં ફેલાવાને રોકવા સાથે મળીને કામ અચૂક કરવું રહ્યું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“એક બહુ મહત્વની બાબત એ છે કે એક સમુદાય તરીકે, આપણે બ્રેમ્પટનમાં COVID-19 નો ફેલાવો ઘટાડવા જરૂરી કાર્ય કરતા રહેવાનું ચાલુ રાખીએ છીએ. હું રહેવાસીઓને મહેરબાની કરીને આપણાં લંબાવેલા બ્રેમ્પટન COVID-19 ઈમરજન્સી મેજર્સ બાય-લો અને મેન્ટેટરી ફેસ કવરિંગ્સ બાય-લો અનુસરવા, અને ઘટાડેલી સામાજિક હળવા-મળવાની સીમાઓનો આદર કરવા કહું છું, જેથી કરીને આપણે સૌ સાથે મળીને, આપણે રિકવરીના આપણાં માર્ગમાં આગળ વધી શકીએ છીએ અને આપણાં સમુદાયનું આરોગ્ય અને સુરક્ષાનું સંરક્ષણ કરી શકીએ છીએ.”

- માર્ટિન મેડેઇરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; લીડ (આગેવાન), મેયરનું રિઓપનીંગ એન્ડ રિકવરી વર્કિંગ ગ્રૂપ, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટીએ આપણાં સમુદાયમાં COVID-19 નાં ફેલાવાને બહુ ગંભીરપણે લેવાનું ચાલુ રાખ્યું છે. આપણાં લંબાવેલા બ્રેમ્પટન COVID-19 ઈમરજન્સી મેજર્સ બાય-લો અને મેન્ટેટરી ફેસ કવરિંગ્સ બાય-લોથી સીટી કર્મચારીઓ, COVID-19 નો ફેલાવો રોકવાના પ્રયત્નમાં વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર અને સામાજિક હળવા-મળવાનું જાળવવામાં અને આપણાં સમગ્ર સમુદાયમાં નોન-મેડિકલ મારક્સના ઉપયોગને પ્રોત્સાહન આપવા, અમલ-બજાવણી કરશે.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન



## Service and Information Update

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूल्फ़ात्मक संवाद

सीटी ओफ़ ब्रॅम्पटन

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)